

RAN-2001130704010001**M.A. Economics (Sem.-IV) Examination March - 2026****Theories of International Trade.****Time: 2 Hours]****[Total Marks: 50****સૂચના : / Instructions**

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book
- (2) પ્રશ્ન નં.-1 ફરજિયાત છે.
- (3) પ્રશ્ન નં.-4 માં કોઈપણ બે ટૂંકનોંધ લખો.
- (4) પ્રત્યેક પ્રશ્નના ગુણ જમણી બાજુ દર્શાવ્યા છે.
- (5) All questions are compulsory.
- (6) Figures to the right indicate full marks of questions.

Seat No.:

Student's Signature

- પ્ર-1. નીચેના પ્રશ્નોનાં ટૂંકમાં જવાબ આપો. 10**
- 1) તુલનાત્મક ખર્ચલાભ એટલે શું?
 - 2) અસરકારક જકાત એટલે શું?
 - 3) જકાતસંઘને અસર કરતાં પરિબળો જણાવો.
 - 4) TRIPS અને TRIMS નું પરુ નામ જણાવો.
 - 5) અવમૂલ્યની સફળતા માટે મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ જણાવો.
- પ્ર-2. હેબરલરનો વૈકલ્પિક ખર્ચનો સિદ્ધાંત વિગતે સમજાવો. 13**
- અથવા**
- પ્ર-2. જકાત એટલે શું? જકાત અવરોધો અને બિન જકાત અવરોધોની ચર્ચા કરો.**
- પ્ર-3. આંતરાષ્ટ્રીય નાણાં ભંડોળની સવિસ્તાર સમજૂતી આપો. 13**
- અથવા**
- પ્ર-3. મૂડીખાતું એટલે શું? લેણદેણ તુલામાં અસમતુલા દૂર કરવા માટેના અભિગમોની ચર્ચા કરો.**
- પ્ર-4. નીચેનામાંથી કોઈ પણ બે ટૂંકનોંધ લખો. 14**
- 1) રિબૅન્સકી પ્રમેય.
 - 2) વેપારની શરતોને અસર કરતાં પરિબળો.
 - 3) UNCTAD.
 - 4) ભારતમાં વિદેશી મૂડીરોકાણ.

ENGLISH VERSION

Q-1. Answer the following questions in brief: 10

- 1) What is comparative cost Advantage?
- 2) What is effective rate of tariff?
- 3) State the factors affecting of custom union.
- 4) Write the full forms of TRIPS and TRIMS.
- 5) State the concept of elasticity for the success of Devaluation

Q-2. Explain the opportunity cost theory of heberler in details. **13**

OR

Q-2. What is tariff? Discuss the tariff barrier and non-tariff barrier in details.

Q-3. Give the detailed explanation of International Monetary Fund. **13**

OR

Q-3. What is capital account? Discuss the approaches to eliminate imbalance in the balance of payment.

Q-4. Write any Two short notes :- **14**

- 1) Rybczynski theorem.
- 2) Factor affecting terms of trade.
- 3) UNCTAD.
- 4) Foreign Investment in India.